

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૮/૨૦૧૮ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૧૮/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૩ કેસ કરી, ૫૧ વ્યક્તિઓને ઝડપી, ૨૨૭ લીટર દેશી દારૂ, ૧૬૧ બોટલ ઇંગ્લીશ દારૂ, ૨૮૫ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૨૦ બિયર ટીન, ૧ રીક્ષા અને ૨ સ્ફટક કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૧૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૦૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૧૯/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૮૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૮ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૫૨૦/૧૮

ગુજરાત યુનિવર્સિટી: હરેશ રામચંદ્ર હરીયાળી (ઉ.વ.૪૮) (રહે. સ્વામિનારાયણ ફ્લેટ ચંદ્રનગર સોસાયટી નારાયણનગર રોડ પાલડી) એ તા.૭/૮/૧૮ નારોજ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે એપ્રિલ-૨૦૧૬ થી આજદીન સુધીના સમયગાળા દરમિયાન આરોપી (૧) કમલેશ વિરુમલ પનમાણી (૨) પરમેશ્વરી વિરુમલ પનમાણી (બન્ને રહે. જુના હાઉસીંગ બોર્ડ કુબેરનગર) એ ભેગા મળી ગુલબાઈ ટેકરા શાખા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ખાતેથી સીસી ફેસીલીટી હેઠળ રૂપિયા ૭૦,૦૦,૦૦૦/- સ્ટોક લેવા સારુ લોન મેળવી જે સ્ટોક ઉપર બેંકની માલીકી હોવા છતાં તથા હાયપોથીકેશન કરાર કરેલ હોવા છતાં સ્ટોક બારોબાર વેચી મારી બેંક સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.કે.ઠાકોર ચલાવે છે.

દરિયાપુર: જ્ઞાનપ્રકાશ દિનેશભાઈ મહેશ્વરી (રહે. સુર્યા એપાર્ટમેન્ટ પારસનગર સોલા રોડ નારણપુરા) એ તા.૭/૮/૧૮ નારોજ દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૮/૫/૧૮ નારોજ આરોપી કેવ ઈટેબલ પ્રા.લી.નામની કંપનીના માલીક ગૌરવભાઈ (એમ.ડી) (રહે.ભાવનગર) એ દરિયાપુર ચોખાબજાર મહેશ્વરી સેલ્સ નામની દુકાન ખાતે મિઠાઈના ધંધા બાબતે માલ મોકલતા એક્સપાઈચર થયેલ માલ હોય જે પરત બદલાવી આપવાનું કહેતા બદલાવી નહીં આપી માલના રૂપિયા ૫,૨૫,૦૦૦/- નહીં ચુકવી જ્ઞાનપ્રકાશ મહેશ્વરી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી યુ.એફ.રાઓલ ચલાવે છે.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૧૫૨૧/૧૮

જીઆઈડીસી વટવા: સંદિપભાઈ મહેશભાઈ પટેલ (રહે. ગીરીવર ગેલેક્ષી હોટલ ફ્લોરાની બાજુમા વસ્રાલ) એ તા.૭/૮/૧૮ નારોજ જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૦૭/૧૮ રાતના ૮/૩૦ થી તા.૨૭/૦૭/૧૮ કલાક ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન વટવા જીઆઈડીસી વિઝોલ પાટીયા પાસે અંબા એસ્ટેટ શેડ નંબર-૩૭ શ્રીશિવમ એજીનીયરીંગના ગોડાઉનમાંથી એસ.એસ.ની પ્લેટના ટુકડા આશરે ૧૦૦ કિલોગ્રામ તથા લોખંડના ટુકડા આશરે ૨૫૦ કિલોગ્રામ કુલ કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.એન.વાઘેલા ચલાવે છે.

સોનાની ચેઈન ઝુટવી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૫૨૨/૧૮

માધવપુરા: સુનિતાબહેન વા/ઓ કમલેશભાઈ જોષી (ઉ.વ.૩૧) (રહે.એલ.આર.એપાર્ટમેન્ટ માધવપુરા) તા.૭/૮/૧૮ રાતના ૮/૩૦ વાગ્યાના સુમારે રઘુકુળ સોસાયટીના દરવાજા નજીકથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ સુનિતાબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સુનિતાબહેન જોષીએ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે.આ ગુનાની તપાસ પોસઇશ્રી જે.ડી.બારોટ ચલાવે છે.

સરદારનગર: સુનિલભાઈ પ્રેમચંદ ખેટપાલ (રહે. હરેકૃષ્ણ સોસાયટી જૈન દેરાસરની બાજુમા કૃષ્ણનગર) તા.૭/૮/૧૮ રાતના ૯/૪૫ વાગ્યાના સુમારે સુનિલભાઈ તેમની માતા રાજકુમારી (ઉ.વ.૫૨) એક્ટીવા પર બેસી સરદારનગર માયા સિનેમા કમલ સ્વીટ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ સુનિલભાઈની માતા રાજકુમારીના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૪૩,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સુનિલભાઈએ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.કે.બ્રહ્મભટ્ટ ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૧૫૨૩/૧૮

નિકોલ: નયન વિનુભાઈ પટેલ (રહે.સુર્યમ ફ્લોરા વૃંદાવન પાર્ટી પ્લોટ સામે નિકોલ) એ કે તા.૬/૮/૧૮ રાતના ૮/૦૦ વાગે નિકોલ કઠવાડા જીઆઈડીસી રોડ નંબર-૮ ત્રિભોવન એસ્ટેટ રોડ નંબર-૬૨ પાછળ ટ્રક નંબર જીજી ૧૮ એટી ૯૨૬૬ કિંમત રૂપિયા ૭,૫૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૭/૮/૧૮ સવારના ૯/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ નયન પટેલે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.વી.પટેલ ચલાવે છે.

ગુંગળામણ થતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૫૨૪/૧૮

આનંદનગર: સવિતાબહેન વિષ્ણુભાઈ પટેલ (ઉ.વ.૫૧) (રહે.શેષનગર સોસાયટી સરિતા સ્કુલની બાજુમા આનંદનગર) તા.૨૪/૭/૧૮ રાતના સમયે બાથરૂમમાં એસીડ નાખી બાથરૂમ સાફ કરતા હતા ત્યારે એસીડની વાસથી ગુંગળામણ થતા બેભાન થઈ જતા સારવાર માટે મેડિલીંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૦૭/૦૮/૧૮ સાજના ૬/૧૫ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે આનંદનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રઝાકભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.